



હાથ કેવી રીતે ધોશો

૧




પાણી વડે હાથ
ભીના કરો

૨




જરૂરી એટલો સાબુ આખા
હાથમાં લગાવો.

૩




હથેળી સાથે હથેળી
ધસો

૪




હાથની પાછળ ધસો

૫




આંગળીઆની વચ્ચે

૬




આંગળીઓની પાછળ

૭




અંગૂઠા ધસો

૮




આંગળીઓના ટેરવે
ધસો

૯



હાથને ચોખ્ખા
પાણીથી ધુઓ.

૧૦



તમારા ચોખ્ખા
રૂમાલથી હાથ લૂછો